

JD-102
January-2021
B.Com., Sem.-V
305 : Statistics – V

Time : 2 Hours]**[Max. Marks : 50]**

- સૂચના :**
- (1) સાહાકેલક્યુલેટરનો ઉપયોગ કરી શકશો.
 - (2) આદેખપત્ર વિનંતીથી મળી શકશે.
 - (3) વિભાગ-A માંથી ગમે તે બે પ્રશ્નોના જવાબ લખો. દરેક પ્રશ્નના ગુણા સરખા છે.
 - (4) વિભાગ-B ફરજિયાત છે.

વિભાગ - A

1. (A) (i) નિયત સંકલનના કોઈપણ પાંચ ગુણધર્મો લાખો. **10**
- (ii) સંકલન મેળવો : $\int \frac{3^x \cdot e^{2x} + e^{3x}}{e^{2x}} dx$
- (B) નીચેનામાંથી ગમે તે બે ગણો : **10**
- (i) $\int \left(\frac{x^2}{x+3} \right) dx$
 - (ii) $\int \left(\sqrt[3]{x} - \frac{1}{2}x + \frac{5}{\sqrt[3]{x}} \right) dx$
 - (iii) $\int_{5}^{10} (30-x)^4 dx$
2. (A) (i) પોયશન વિતરણની વ્યાપ્તા આપી તેના ગુણધર્મો જણાવો. **10**
- (ii) 52 પત્તાની જોડમાંથી થદછ રીતે ત્રણ પત્તા લેવામાં આવે તો
- (a) ત્રણેથ પત્તા રાણીના હોથ
 - (b) ત્રણેથ લાલ(hearts) ના હોથ તેની સંભાવના શોધો.
- (B) પોયશન વિતરણનો મધ્યક = 3 છે, તો $P(x \geq 2)$ ની કિંમત મેળવો. **10**
- $(e^{-3} = 0.049)$

3. (A) ટૂંકનોંધ લખો : ઉત્પાદન પ્રક્રિયામાં ગુણવત્તામાં ચલન
 (B) એક ઉત્પાદન પ્રક્રિયા દરમ્યાન દર અડધા કલાકે 4 એકમોના એક એવા નિર્દર્શ લઈ તેમનું ગુણવત્તા લક્ષણ માપવામાં આવે છે. દિવસ દરમ્યાન મળેલ માહિતી નીચે મુજબ છે. તે પરથી \bar{x} અને R આદેખ દોરી પ્રક્રિયા નિયંત્રણ અંગે તમારુ મંતવ્ય જણાવો.
 ભવિષ્યના ઉત્પાદન માટેની નિયંત્રણ સીમાઓ પણ મેળવો.

ନିର୍ଦ୍ଦେଶୀୟ ନଂ.	1	2	3	4	5	6	7	8	9	10
Σx	1316	1272	1340	1348	1312	1280	1304	1364	1324	1420
R	35	20	5	10	5	40	50	20	30	67

(n = 4 માટે A₂ = 0.73, D₃ = 0, D₄ = 2.28)

4. (A) કિયા લક્ષણ વક્ફનો અર્થ સમજાવી તેના ગુણધર્મો જાણાવો. 10

(B) એક નિર્દર્શન ચોજના (100, 10, 1) માટે $AQL = 0.02$ અને $LTPD = 0.05$ હોય તો ઉત્પાદકનું જોખમ અને ગ્રાહકનું જોખમ શોધો. 10

विभाग – B

માંચ્યા મુજબ જવાબ આપો : (ગમે તે પાંચ)

(5) $\int \left(\frac{1}{6 - 7x} \right) dx = \underline{\hspace{2cm}}$

- (a) $\frac{1}{7} \log (6 - 7x) + C$
- (b) $\log (6 - 7x) + C$
- (c) $\frac{1}{-7} \log (6 - 7x) + C$

(6) અતિ ગુણોત્તર વિતરણના કોઈપણ બે ગુણધર્મો લખો.

(7) R નકશા માટે જો $CL = 21.47$, $D_3 = 0$, $D_4 = 2.28$ હોય તો $LCL = \underline{\hspace{2cm}}$.

- (a) 0
- (b) 48.9516
- (c) 19.19

(8) એક નિર્દર્શન ચોજના (100, 18, 1) માટે ખામી પ્રમાણ $P^1 = 0.01$ અને સમૂહના સ્વીકારની સંભાવના P_a = 1 હોય તો ATI ની કિંમત મેળવો.

(9) આંકડાશાસ્ત્રીય ગુણવત્તા નિયંત્રણમાં $\underline{\hspace{2cm}}$ આલેખ (નકશા)માં પોયશન વિતરણનો ઉપયોગ કરવામાં આવે છે.

- (a) \bar{x} -આલેખ
- (b) c-આલેખ
- (c) d-આલેખ

(10) કાચની શીશી (બોટલ)માં રહી ગયેલા હવાના પરપોટાની સંખ્યા $\underline{\hspace{2cm}}$ વિતરણનું ઉદાહરણ છે.

- (a) પ્રામાણ્ય
- (b) પોયશન
- (c) ક્રિપદી

JD-102
January-2021
B.Com., Sem.-V
305 : Statistics – V

Time : 2 Hours]**[Max. Marks : 50]**

- Instructions :**
- (1) Simple calculator can be used.
 - (2) Graph paper will be supplied on request.
 - (3) Attempt any two questions from Section – A. All questions carry equal marks.
 - (4) Section – B is compulsory.

Section – A

1. (A) (i) Write any five properties of Definite Integral. **10**
- (ii) Evaluate : $\int \frac{3^x \cdot e^{2x} + e^{3x}}{e^{2x}} dx$
- (B) Solve any **two** from the following : **10**
- (i) $\int \left(\frac{x^2}{x+3} \right) dx$
- (ii) $\int \left(\sqrt[3]{x} - \frac{1}{2}x + \frac{5}{\sqrt[3]{x}} \right) dx$
- (iii) $\int_5^{10} (30-x)^4 dx$
2. (A) (i) Give definition of Poisson distribution. Also state its properties. **10**
- (ii) Three cards are drawn at random from a pack of 52 cards. Find the probabilities that
- (a) all the cards are of queens
 - (b) all are heart
- (B) For a Poisson distribution, if mean = 3, then find $P(x \geq 2)$ **10**
- $(e^{-3} = 0.049)$

3. (A) Write short note on Causes of variations in a production process. 10

(B) Sample of 4 units each is taken at every half an hour and quality characteristics are measured. The data obtained during a day are as under. Draw \bar{x} and R chart and state your conclusion.

Also, obtain control limit for future production. 10

Sample No.	1	2	3	4	5	6	7	8	9	10
Σx	1316	1272	1340	1348	1312	1280	1304	1364	1324	1420
R	35	20	5	10	5	40	50	20	30	67

(For $n = 4$, $A_2 = 0.73$, $D_3 = 0$, $D_4 = 2.28$)

4. (A) Explain operating characteristic curve and write its characteristics. 10

(B) Find producer's risk and consumer's risk for a single sampling plan (100, 10, 1) when AQL = 0.02 and LTPD = 0.05. 10

Section – B

Do as directed : (any five) 10

(1) If marginal revenue = ₹ 13, then total revenue = _____.

(a) $13x$

(b) $13 + C$

(c) $13x + C$

(2) Mean of a Poisson distribution is 8, then its standard deviation = _____.

(a) 8

(b) $\sqrt{8}$

(c) 8^2

(3) Distribution of fraction defective in p-chart is _____

(a) Normal

(b) Poisson

(c) Binomial

(4) Explain single sampling plan (2000, 15, 3).

(5) $\int \left(\frac{1}{6-7x} \right) dx = _____$

(a) $\frac{1}{7} \log (6 - 7x) + C$

(b) $\log (6 - 7x) + C$

(c) $\frac{1}{-7} \log (6 - 7x) + C$

(6) State any two properties of hypergeometric distribution.

(7) For R-chart : CL = 21.47, D₃ = 0, D₄ = 2.28, then LCL = _____.

(a) 0

(b) 48.9516

(c) 19.19

(8) For a single sampling plan (100, 18, 1) proportion of defective of the lot P¹ = 0.01 and probability of the acceptance of lot P_a = 1, find ATI.

(9) Poisson distribution is used in _____ chart of statistical quality control.

(a) \bar{x} -chart

(b) c-chart

(c) d-chart

(10) Number of air bubbles in a glass bottle follows _____ distribution.

(a) Normal

(b) Poisson

(c) Binomial
